

ગોબર ગેસનું મહત્વ અને તેની ઉપયોગિતા

એક દિવસીય ખેડૂત તાલીમ અને નિર્દર્શન કાર્યક્રમ

આણંદ કૃષિ યુનિવર્સિટી ની કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી કોલેજ, ગોધરા ખાતે “એડવાન્સડ સેન્ટર ફોર રિસર્ચ એન્ડ ટ્રેઈનર્સ ટ્રેઈનિંગ ઓન એગ્રિકલ્યુરલ એન્જિનિયરિંગ બેજ ઇન્ટરવેન્સન્સ” પ્રોજેક્ટ અંતર્ગત રિન્યુએબલ એનજી એન્જિનિયરિંગ વિભાગ અને આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર, દેવગઢબારિયા ના સંયુક્ત ઉપક્રમે “ગોબર ગેસનું મહત્વ અને તેની ઉપયોગિતા” વિષય પર તારીખ 30/01/2020 ના રોજ એક દિવસીય ખેડૂત તાલીમ અને નિર્દર્શન કાર્યક્રમ આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર, દેવગઢબારિયા યોજયો. આ કાર્યક્રમમાં માસીતોયણી અને ખૂટતોયણી ગામમાંથી ૫૦ જેટલા ખેડૂત મહિલાઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમ ની શરૂઆત પદ્ધારેલ મહેમાનોનું પુષ્પગુણ આપીને કરાઇ હતી.

આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ડૉ. પંકજ ગુપ્તા, ઇન્દ્રાજિત આચાર્ય અને વિધ્યાશાખાધ્યક્ષશ્રી (એગ્રીકલ્યુરલ એન્જિનિયરિંગ), કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી કોલેજ, ગોધરા, ડૉ. જી. જી. પટેલ, યુનિટ અધિકારીશ્રી, આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર, દેવગઢબારિયા તેમજ કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી કોલેજ ના અને દેવગઢબારિયાના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ હાજર રહ્યા.

કોલેજના ઇન્દ્રાજિત આચાર્ય અને વિધ્યાશાખાધ્યક્ષશ્રી ડૉ. પંકજ ગુપ્તા એ તાલીમાર્થીઓને બાયોગેસ ટેકનોલોજી એ વધતી જતી ઉજ્જને પહોંચી વળવા માટે સૌથી યોગ્ય વિકલ્પ તેમજ ઘરોમાં પ્રકાશ, સિંચાઇ અને નાના ઉદ્યોગો માટે પણ બાયોગેસની ઉપયોગિતા થી માહિતગાર કર્યા. વધુમાં ડૉ. પંકજ ગુપ્તા એ ફાર્મ યાંત્રિકીકરણ નો ખેતીમાં ઉપયોગ કરી ખેડૂત તેની આવક કેવી રીતે વધારી શકે તેની માહિતીપણ આપેલ હતી. ડૉ. જી. જી. પટેલ, યુનિટ અધિકારીશ્રી, આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર, દેવગઢબારિયા એ ખેડૂત મહિલાઓને ખેતીમાં બાયોગેસ ના ફાયદાઓ વિષે તથા જુદી જુદી ખેત આડપેદાશોમાંથી બાયોગેસ કેવી રીતે ઉત્પન્ન થાય અને બાયોગેસ સ્લરીનો ખેતરમાં ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે તેમ જાણાવેલ હતું.





સદર તાલીમમાં ડૉ. ડી. કે. વ્યાસ, વિભાગીય વડા (આર. ઇ. ઇ.) અને સદર યોજના ના પી. આઈ. કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી કોલેજ, ગોધરા દ્વારા “ગોબર ગેસ એટલે શું? અને તેની પ્રાણીનતા” અને “જુદા જુદા કચરા/ ખેત આડપેદાશોનો બાયોગેસમાં ઉપયોગ” વિષય પર તેમજ ઈજ. જે. શ્રવણકુમાર, બી. ઇ. એ. એસ. વિભાગ “સૂર્યકુકરનું મહત્વ અને તેની ઉપયોગીતા” વિષય પર વ્યાખ્યાન આપ્યા. તદ્વારા મહિલા તાલીમાર્થીઓને બોક્સ ટાઇપ સૂર્યકુકર કેવી રીતે કાર્ય કરે છે અને તેની અંદર ઢોકળા તેમજ ભાત બનાવી તેનું સીધું પ્રાયોગિક નિર્દર્શન તેમજ ટોપ ફિલ્ડિંગ ટાઇપ નિર્ધૂમ ચૂલાનું પણ સીધું પ્રાયોગિક નિર્દર્શન કરી બતાવવામાં આવેલ હતું. મહિલા ખેડૂત બહેનોએ સદર તાલીમમાં બતાવેલ બાયોગેસ ની ઉપયોગીતા, બોક્સ ટાઇપ સૂર્યકુકર તેમજ ટોપ ફિલ્ડિંગ ટાઇપ નિર્ધૂમ ચૂલા તેમણે કેવી રીતે ઉપયોગી થશે તેના અભિપ્રાય પણ આપેલ હતા.

તાલીમ ના અંતે ડૉ. ડી. કે. વ્યાસ, વિભાગીય વડા (આર. ઇ. ઇ.) અને સદર યોજના ના પી. આઈ. દ્વારા આમંત્રિત મહેમાનો, ખેડૂત બહેનો તેમજ આયોજકોની આભાર વિધિ કરવામાં આવી હતી.